

Corporate Office & Communication Address:

40I Aza House, 24, Turner Road, Bandra (W), Mumbai 400 050. Website: www.panamapetro.com Phone: 9I-22-42I77777 I Fax: 9I-22-42I77788 I E-mail: ho@panamapetro.com CIN No. L23209GJI982PLC005062

August 06, 2024

BSE Limited

Pjiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai 400 001

Scrip Code: 524820

National Stock Exchange of India Limited

Exchange Plaza, 5th Floor, Plot No. C/1 G Block, BKC, Mumbai-400 051

Scrip Symbol:PANAMAPET

Sub: Newspaper clippings - Notice of Annual General Meeting and E-voting information

Dear Sir/ Madam,

Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of the newspaper advertisement related to Notice of the Annual General Meeting and E-voting information, published on August 6, 2024, in English and regional (Gujarati) newspapers.

You are requested to take the above on your records.

Thanking You

Yours faithfully,
For PANAMA PETROCHEM LIMITED

Gayatri Sharma Company Secretary & Compliance Officer



PANAMA PETROCHEM LIMITED

Regd. Office :Plot No.3303,GIDC Estate, Ankleshwar, Gujarat-393002 Corp. Office: 401, Aza House,24 Turner Road, Bandra (W), Mumbai, Maharashtra-400050 Website :www.panamapetro.com CIN No. :L23209GJ1982PLC005062 Phone:91-22-42177777, E-mail:cs@panamapetro.com

NOTICE OF AGM AND E-VOTING

Notice is hereby given that the 42" Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Thursday, August 29, 2024 at 11:30 A.M. IST through Video Conferencing('VC')/ Other Audio Visual Means ('OAVM') in compliance with all the applicable provisions of the Companies Act, 2013, and the rules made thereunder, and the Securities & Exchange Board of India ("SEBI") Listing Obligations & Disclosure Requirements, 2015 read with all the applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs (MCA) and the Securities and Exchange Board of India (SEBI), to transact the business set out in the Notice calling the AGM. Members participating through the VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

In compliance with the relevant circulars, Annual Reports for F.Y. 2023-2024 including Notice of the meeting has been sent on August 05, 2024 to the Members of the Company whose e-mail addresses are registered with the Company/Depository Participant(s). The aforesaid documents are also available on the Company's website at www.panamapetro.com.and on the website of the Stock Exchanges, I.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively. The notice of the AGM is also available on the CDSL website: www.evotingindia.com

In compliance with Section 106 of the Companies Act, 2013, ('the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing to its Members the facility of remote e-voting and e-voting during the AGM in respect of the business to be transacted at the AGM and for this purpose, the Company has appointed CDSL for facilitating voting through electronic means.

The voting related details are given below:

- . The remote e-voting shall be opened from, Monday, August 26, 2024 at 9:00 A.M. to Wednesday, August 28, 2024 till 5:00 P.M. The remote e-voting module will be disabled for voting thereafter.
- The business as set forth in the Notice of the 42rd AGM, shall be transacted through remote e-voting and/or e-voting system at the AGM.
- The cut-off date for members eligible to vote is August 22, 2024.
- . Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of the notice and holding shares as on the cut-off date i.e. August 22, 2024, may obtain the login ID and password as per the instructions given in the Notes of the notice of 42" AGM
- The facility for e-voting will also be made available during the AGM and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the AGM and upto the expiry of 15 minutes from the conclusion of the AGM.
- A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting at the AGM.
- . The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not cast their vote again.
- . The manner of voting remotely for members holding shares in dematerialized mode. physical mode and for members who have not registered their e-mail addresses is provided in the Notice of the AGM. The details will also be made available on the website of the Company. Members are requested to visit www.panamapetro.com to obtain such
- . The Notice of the AGM has also been uploaded on the Company's website. www.panamapetro.com and CDSL website: www.evotingindia.com
- For any queries connected with remote e-voting, members can contact to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25° Floor, Marathon Futurex, Mafatlai Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk evoting@cdslindia.com or call

Manner of registering/updating e-mail addresses:

 a)Members holding shares in physical mode, who have not registered/updated their email addresses with the Company, are requested to register/update the same by sending the original Form ISR-1 along with the required supporting documents to the Registra of the Company. The Form ISR-1 is available on the website of the Company at http://panamapetro.com/wp-content/uploads/2023/05/Form_ISR-1_p.pdf and the website of our RTA- Bigshare Services Pvt. Ltd. at: https://www.bigshareonline.com/

 Members holding shares in dematerialised mode, who have not registered/updated their e-mail addresses with their Depository Participants, are requested to register. update their e-mail addresses with the Depository Participants with whom they maintain their demat accounts.

By order of the Board For PANAMA PETROCHEM LIMITED

Place: Mumbal Date : August 05, 2024

Gayatri Sharma Company Secretary & Compliance Officer

CLASSIC FILAMENTS LIMITED

Regd. Office: Plot No.1, Priyanka House, Umiyadham Road, Varachha, Surat-395006

CIN L17114GJ1990PLC013667 | Tel:0261-2540570 email: classicfilaments@ymail.com, Website: www.classicfilamentsltd.com NOTICE OF 34thANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING **INFORMATION & BOOK CLOSURE**

Notice is hereby given that the 34th Annual General Meeting (the "Meeting" of CLASSIC FILAMENTS LIMITED will be held on Thursday,5th September, 2024 at 11.00 a.m. IST through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM"). In compliance with General Circulars dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 14, 2021, May 5, 2022, December 28, 2022, September 25, 2023 and other applicable circulars, if any, issued by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and Circular dated May 12, 2020, January 15, 2021, May 13, 2022, January 5, 2023, October 7, 2023 and other applicable circulars, if any, issued by the Securities and Exchange Board of India ('SEBI Circular'), Companies are allowed to hold AGMs through VC/OAVM, without the presence of Members at common venue. Hence the AGM of the Company is being held through VC / OAVM to transact the business set out in the Notice calling the AGM.

In compliance with the above circulars, Electronic copies of the Notice of the AGM and Annual Report for the Financial Year 2023-24were sent to all the Shareholders whose email address are registered with the Company/Depository Participants. The electronic dispatch of Annual Report to the Shareholders has been completed on 5th August, 2024. The Annual Report including Notice of AGM shall also be available on the Website of the Company www.classicfilamentsltd.com and on the website of the Stock Exchange www.bseindia.com.

Members holding shares either in physical form or in dematerialized form, as on cut-off date 29th August, 2024, may cast their vote electronically on the business as set out in the notice of the AGM through Electronic voting system. provided by NSDL from place other than the venue of the AGM (Remote E-

voting) or e-voting system at the AGM. All the members are informed that:

- The remote e-voting period commences on Monday, 2ndSeptember, 2024 at 9:00 am IST
- ii. The remote e-voting period shall end on Wednesday, 4th September, 2024 at 5:00 pm IST
- iii. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is Thursday, 29th August, 2024.
- The E-voting shall not be allowed beyond 5.00 P.M.IST on 4th September, 2024. The E-voting module shall be disabled by NSDL for voting thereafter.
- Once the vote on the resolution is cast by the Members, it cannot be changed subsequently. vi. The Notice is emailed to Members, whose names appear in the Register
- of Members/List of beneficial Owners as on Friday, 2nd August, 2024. Members who have acquired shares after the dispatch of Notice and before the cut-off date i.e Thursday, 29th August, 2024may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or admind@skylinerta.com and contact@skylinerta.com / classicfilaments@ymail.com
- vii. Members who have casted their vote through remote e-voting prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their vote again.
- viii. The facility for voting shall also be available during the meeting and the members attending the AGM who have not already cast their vote by remote e-voting shall be able to exercise their vote through e-voting system at the AGM.
- ix. The manner of remote e-voting for members holding shares in dematerialized mode, physical mode and for Members who have not registered their email addresses is provided in the Notice of the AGM. Members who have not yet registered their email addresses are requested to follow the process mentioned in the notice of AGM, to receive login ID and password for e-Voting.
- x. In case shareholders/ members have any queries or issues regarding evoting, you may refer the Frequently Asked Questions ("FAQs") and evoting manual available at the download section of

www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990. Notice is also hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday,29th August, 2024 to Thursday,5thSeptember, 2024(both days inclusive) for the purpose of the AGM.

For CLASSIC FILAMENTS LIMITED

Place : SURAT Date: 06-08-2024 JAYANTI GAUDANI Managing Director DIN-03571671



therein would remain unchanged.

| Date : 05.08.2024 | Place : Surat

Zonal Office, Surat, 101-102, 3rd Floor, Westfield Square, Vesu, Surat-395007, Corrigendum

Chief Manager, Authorized Officer,

Indian Bank

Please refer to our E-Auction notice published in Financial Express on Dated **04.08.2024** on Page No.17. Sr.No.37 1. Papulal Rathi (Borrower), 2. Hiralal Rathi (Co-Borrower) and 3. Jaya R Gandhi (Guarantor) Please read Description of the Immovable/Movable property As -All the piece and parcel of the property being Flat No.A/204, built up area admeasuring 764.00 sq.fts equivalent to 70.97 sq.mtrs, Tower-A, Second Floor of Vivek Residency

with all appurtenances pertaining thereto, standing on land bearing R.S. No.18/1

Block No.24, admeasuring 3440 sq. mtrs., of vill. Saniya Hemad, Sub. Dist. Choryasi,

Sr.No. 38 1. M/s Diamond Plastic Industries (Partnership Firm), 2. Sunil Tukaram Ajarekar (Partner & Guarantor), 3. Asif Siraj Jariya (Partner & Guarantor), 4. Asmita Alnawaz Bhimani (Partner & Mortgagor & Guarantor), 5. Nasim Siraj Jariya (Guarantor) Please read Description of the Immovable/Movable property As - Flat No. 15-223/A/4TH-5 adm. 700.00 sq ft super built-up area on the 4th floor of the building as Nilkanth Apartment constructed upon N A land S No 543/2-E adm 399.00 sq. mtrs. at Dunetha, Nani Daman, Tal. & Dist. - Daman. Other terms and condition published

POSSESSION NOTICE DCB BANK

The undersigned being the authorized officer of the DCB Bank Ltd., under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice on below mentioned dates calling upon the borrowers (Borrower's and Co-Borrower's) to repay the amount mentioned in the notice as detailed below in tabular form with further interest thereon from within 60 days from the date of receipt of the said notice. The borrower and Co-Borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, Co-Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 also r/w section 14(1) of the Security

Interest Rules 2002 on 03rd August, 2024. The borrower, Co-Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property (Description of the immovable Property) and any dealings with the property will be subject to the charge of the DCB Bank Ltd., for respective amount as mentioned here below. The Borrower's attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the act, in respect of time available, to redeem the secured assets.

Name of Borrower(S)	
and (Co-borrower(S)	MR. HASMUKHBHAI HIRJIBHAI JOTANIYA, MRS. HEMIBEN HASMUKHBHAI JOTANIYA and MR. JIGNESHBHAI HASMUKHBHAI JOTANIYA
Loan account no.	DRBLSUR00407530/DRBLSUR00509794
Total Outstanding Amount.	Rs.8,08,010.69/- (Rupees Eight Lakh Eight Thousand Ten and Sixty-Nine Paisa Only) as on 2nd May 2024
Description Of The Immovable Property	ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY FLAT NO. 403 ADMEASURING 665 SQ.FTS. I.E. 61.80 SQ. MTRS. ALONG WITH UNDIVIDED SHARE IN LAND, FOURTH FLOOR BUILDING NO. D PARTH COMPLEX NEAR DHANMORA CHAR RASTA KATARGAM SINGANPORE ROAD DEVELOPED UPON LAND SITUATED IN STATE GUJRAT DIST: SURAT TALUKA: CHORYASI MOJE KATARGAM BEARING REVENUE SURVEY NO 506 PAIKEE D.T.P. SCHEME NO.18 FINAL PLOT NO 92 PAIKEE PLOT NOS.A/1, A/2, A/3. (The Secured Assets)"

ALLAHABAD

Bamaniya Faliyu Motirel (west) Motirel, Santrampur

Place: - Surat.

Δ इलाहाबाद

Godhra Branch, Nr. M and M Mehta High School, Baharpura, Gujarat-389001 Ph.: 02672-241892

AUTHORISED OFFICER

Rule-8(1) POSSESSION NOTICE (for immovable property) Notice under Sec.13 (4) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002

Whereas, The undersigned being the Authorized Officer of the Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 18.04.2024 Calling upon the borrower Mr. Sarvatsinh Mansukhbhai Bamniya (Borrower and mortgagor)

Dist Panchmahal with our Godhra Branch to repay the amount mentioned in the notice being for Rs. 7,93,901/- (Rupees Seven Lakh Ninty Three thousand nine hundread one Only) as on 17.04.2024 within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him / her under Section 13 (4) of the said Act read with rule 8 and 9 of the said rules on this **3rd of August of the year 2024**. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property

and any dealings with the property will be subject to the charge of the Indian Bank Godhra Branch for an amount of Rs. 412014/- (Rupees Four lakh twelve thousand fourteen Only) as on 03/08/2024 with further interest, cost, other charges and expenses thereon from 03/08/2024. DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Address of the property	Owned by
Mortgaged Assets: Revenue survey no.479 Paiki 1 Paiki 2/Paiki1/Paiki1, N.A. Residential land paiki Private plot nos.1,2,3,4,5 total adm 2065 sq.mtr.N.A. Land constructed Residential Building known As "KABIR COMPLEX "Paiki second Floor Flats Paiki Flat No.S-1,adm .60.75 sq.mtrs with undivided land Paiki adm. 47.25 sq. mtrs situated in village Saliya Tal Morva(H) dist. Panchmahai, Gujarat bounded by, East: Boundry of Lagu S.no.479 paiki, West: Boundry of land of RS no.479 Paiki1/Paiki2/Paiki1/Paiki1.	Mr. Sarvatsinh Mansukhbhai Bamaniya

Chief Manager/Authorized Officer Date: 03.08.2024 Indian Bank, Godhra Branch



Place : Godhra

Reg. Office: Corporate House No. A-1, Shivalik Business Centre, B/h. Raipath Club, S. G. Highway, Bodakdev, Ahmedabad-380059, Contact No.07940091111 Website: www.a1acid.com, E-mail: info@a1acid.com

CIN: L24119GJ2004PLC044011 NOTICE OF 20TH ANNUAL GENERAL MEETING AND BOOK CLOSURE

Notice is hereby given that the 20 th Annual General Meeting (AGM) of the Members of A-ACID LIMITED will be held on Thursday, 29th August, 2024 at 11:00 A.M. IST through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) in accordance with the Ministry of Corporate Affairs (MCA) Circular No. 14/2020 dated April 08, 2020; Circular No.17/2020 dated April 13, 2020 followed by Circular No. 20/2020 dated May 05, 2020, Circular No. 10/2022 dated December 28, 2022 and Circular No. 09/2023 dated September 25, 2023 read with read with SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/ CIR/P/2020/79 dated May 12, 2020, SEBI/HO/CFD/CMD2/ CIR/P/2021/11 dated January 2021, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 May 13, 2022, SEBI/HO/CFD/PoD-2/ P/CIR/2023/4 dated January 5, 2023 and SEBI/HO/CFD/CFD-PoD/2/P/CIR/2023/167 dated October 7,2023 issued by SEBI without the presence of the Members to transact the businesses as set out in the Notice of the 20 th AGM.

Considering the above circulars, The Notice of the 20 th AGM including Annual Report for F.Y. 2023-24 along with the login details of joining of 20 th AGM will be sent only by email to those Members holding shares as on 02 nd August, 2024 whose email address are registered with the Company or its Registrar & Share Transfer Agent (RTA) or with their respective Depository Participants. The Notice of the 20 th AGM and Annual Report for the year ended 31 st March, 2024 will also be available on the website of the Company at www.a1acid.com and on the website of Stock Exchange i.e. for BSE Limited at www.bseindia.com.

Members holding shares of the company as on 22 nd August, 2024, cutoff date is eligible

The Members can join and participate in the 20th AGM through VC/OAVM facility only. The instruction for joining the 20 th AGM and the manner participation in the remote electronic voting or casting voting through e-voting system during the 20 th AGM provided in the Notice of the 20 th AGM. The E-voting Period commences on Monday, 26th August, 2024 at 9:00 A.M. IST and ends on Wednesday, 28 th August, 2024 at 05:00 P.M. IST voting hrough remote electronic mode shall not be permitted beyond on 05:00 P.M. IST on the

businesses as set out in the notice of AGM. Members joining the meeting through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) who have not cast their vote by means of remote e-voting, shall be able to exercise their right to vote through e-voting at the AGM. The members who have already cast their vote by remote E-Voting prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their vote again.

Members whose email addresses are not registered with the depositories Participants are requested to contact to Depository Participants (DP) and registered their email address in their Demat Account as per process advice by depositories Participants for obtaining login credentials for e-voting for the resolutions proposed in the Notice of 20 th AGM in the Following Manner:

For Demat Shareholder: Please provide Demat account details(CDSL- 16 digital beneficiary ID or NSDL-16 digit DPIN + CLID), Name of Shareholder, client master or copy of Consolidated Account Statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhar (self-attested scanned copy of Aadhar card) to the Company email ID at

The Company/RTA shall coordinate with the depositories and provide the login credentials to the above mentioned shareholders.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and upto the cut-off date, may obtain the Login ID and Password by sending a request to Depository or Depository Participant or to the Company at their respective Email Ids or other available modes of communication. If a shareholder is already registered with NSDL/CDSL for E-Voting, then existing user ID and password can be used for casting vote. In Case of queries relating to e-voting, member/beneficial owners may contact to Mrs.

Nidhi Anjan Chokshi, Company Secretary at 07940091111 or mail at cs@a1acid.com or refer the Frequently Asked Questions and e-voting user manual available at the NSDL web site: www.evoting.nsdl.com or contact to 022-4886 7000 and 022-2499 7000 or Email at evoting@nsdl.co.in.

The Notice is further given that Pursuant to the Provision of Section 91 of the Companies Act, 2013 read with rule 10 of Companies (Management and Administration) Rules, 2014, the Register of Member and Share Transfer Book of the Company shall be closed from Friday, 23rd August, 2024 to Thursday, 29 th August, 2024 (both days inclusive) ("Book Closures Date") for the purpose of ascertaining the eligible shareholders for participating in AGM and Declaration of Final Dividend for the financial year ended March 31,2024.

Date: 05.08.2024 For, A-1 ACID LIMITED, Sd/- Nidhi Anjan Chokshi, Company Secretary Place: Ahmedabad

INDIAN OVERSEAS BANK Asset Recovery Management Branch (2581)-Ahmedabad Ground floor, Sharad Shopping Centre, Chinubhai tower, Opp. Old Handloom House, Ashram road, Ahmedabad – 380009

E-mail: iob2581@iob.in; Website: www.iob.in; Mob. 89259-52581

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES [Under Proviso to Rule 8(6) of Security Interest (Enforcement) Rules] E-auction Sale Notice for Sale of Immovable Assets under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and guarantor/s that the below described immovable property mortgaged/charged to the Secured creditor, the Physical possession of which has been taken by the Authorized Officer of Indian Overseas Bank, Secured Creditor, will be sold on "As is where is" "As is what is" and "Whatever there s" condition on 27.08.2024 for recovery of Rs. 7,16,44,777.94 (Rupees Seven crores sixteen lakhs forty four thousand seven hundred and seventy seven and paise ninety four only as on 03.08.2024 due to the Secured Creditor from the borrower M/s Denim Online Exports Private imited, Guarantors Mr. Aman Anand Arya, Mr. Anand Arya, M/s Softech Designs Private. Limited and Mortgagors M/s Softech Designs Private Limited.

	DESCRIPTION OF THE IMMOVABLE PROPER	RTY	
SI. No.	Details of the property	Reserve Price In ₹	EMD In ₹
1	Office No. 1004 admeasuring approx. 1070 Sq. Feet built up area, bearing Municipal Tenement No. 0517-25-2546-0001-E, Municipal Ward No. 0517 and Municipal Ward Name: Sardar Patel Stadium, as per AMC Property Tax Bill on the Tenth floor in a building known as "Nar-Narayan Complex" Near Swastik Char Rasta, Navrangpura, Ahmedabad, Gujarat - 380009, constructed, situated and lying upon Non-agriculture land bearing Sub-plot No's. 1/A, 1/B, 2/A, 2/B, 3/A and 3/B of Nar-Narayan Government Servants Co-operative Housing Society Limited situated upon land bearing final Plot No. 259, Town Planning Scheme No. 3 at Mouje: Sheikhpur - Khanpur, Taluka: Ahmedabad City (West), District: Ahmedabad, Sub-District: Ahmedabad-3 (Memnagar)	Rs. 34,66,800/-	Rs. 3,46,680/-
2	Office No. 1005 admeasuring approx. 590 Sq. Feet built up area, bearing Municipal Tenement No. 0517-25-2551-0001-E, Municipal Ward No. 0517 and Municipal Ward Name: Sardar Patel Stadium, as per AMC Property Tax Bill on the Tenth floor in a building known as "Nar-Narayan Complex" Near Swastik Char Rasta, Navrangpura, Ahmedabad, Gujarat - 380009, constructed, situated and lying upon Non-agriculture land bearing Sub-plot No's, 1/A, 1/B, 2/A, 2/B, 3/A and 3/B of Nar-Narayan Government Servants Co-operative Housing Society Limited situated upon land bearing final Plot No. 259, Town	Rs. 19,11,600/-	Rs. 1,91,160-

Ahmedabad-3 (Memnagar) Office No. 1006 admeasuring approx. 1240 Sq. Feet built up area, bearing Municipal Tenement No. 0517-25-2556-0001-U, Municipal 40,17,600/-4,01,760/-Ward No. 0517 and Municipal Ward Name: Sardar Patel Stadium, as per AMC Property Tax Bill on the Tenth floor in a building known as "Nar-Narayan Complex" Near Swastik Char Rasta, Navrangpura, Ahmedabad, Gujarat - 380009, constructed, situated and lying upon Non-agriculture land bearing Sub-plot No's, 1/A, 1/B, 2/A, 2/B, 3/A and 3/B of Nar-Narayan Government Servants Co-operative Housing Society Limited situated upon land bearing final Plot No. 259, Town Planning Scheme No. 3 at Mouje: Shelkhpur - Khanpur, Taluka: Ahmedabad City (West), District: Ahmedabad, Sub-District Ahmedabad-3 (Memnagar)

Planning Scheme No. 3 at Mouje: Shelkhpur - Khanpur, Taluka:

Ahmedabad City (West), District: Ahmedabad, Sub-District:

Date & Time of E-Auction: 27.08.2024 between 11:00 A.M. to 01:00 P.M. Property Inspection date & Time: On 17.08.2024 between 11:00 AM to 01:00 PM • Type of Possession : Physical Known Encumbrance, if any: Nil as per Bank's Knowledge

"Bank's dues have priority over the Statutory dues For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured Creditor's website i.e. www.iob.in & E-auction service provider's web portal : https://ebkray.in For any property related queries, prospective bidders may contact Mr. Harfool Meena, Chief Manager on Mob. 8925952581 & Ms. Aarti Ajwani, Manager on Mob. 756776626. Date: 03.08.2024 Authorised Officer,

Place: Ahmedabad Indian Overseas Bank The Successful highest bidder should pay 1% of the sale price as TDS under Section 194(IA) of Income Tax Act. tis may also be treated as a Notice under Rule 8(6) / Rule 9(1) of Security Interest (Enforcement) Rules 2002 to the borroweris and guaranton's of the said loan about holding of e-auction on the above mentioned date.

CIN: L21308GJ1989PLC012743 Regd. Office: B-18, Gandhinagar Electronic Estate, Gandhinagar-382 024 Corporate Office: 7, Jamshedji Tataroad, Churchgate Reclamation, Mumbai-400 020

Ph: 022 - 2282 0048, E-mail : gpel@kilachand.com, Website : www.gpelindia.in Notice of Postal Ballot and E-voting

NOTICE is hereby given that pursuant to provision of Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 (the 'Act') read with Companies (Management and Administration) Rules, 2014 (Including any statutory modification or re-enactment(s) thereof and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "SEBI Listing Regulations"), Secretarial Standard - 2 issued by the Institute of Company Secretaries of India and other applicable laws and Regulations and the Circulars issued by Ministry of Corporate Affairs ("the MCA Circulars") from time to time, the Resolutions set out in the Postal Ballot Notice of Gujarat Poly Electronics Limited ("the Company") is proposed to be passed by the Members through postal ballot, by means of remote electronic voting ("remote e-voting") only.

Pursuant to MCA Circulars, the Company has completed the dispatch of the Postal Ballot Notice along with the Explanatory Statement on Monday i.e. 5th August, 2024 through electronic mode to the members whose email addresses are registered with the Company/Depository Participant(s) as on 30" July, 2024 (Cutoff Date).

In compliance with Regulation 44 of the SEBI Listing Regulations and Section 110 read with Section 108 of the Act and Rules made thereunder, the Company is pleased to provide e-Voting facility to its Members through the e-Voting platform of NSDL. The Postal Ballot Notice along with the Explanatory Statement, instructions

and manner of e-Voting is available on the Company's website at

www.gpelindia.in, website of Bombay stock exchange at www.bseindia.com and the website of NSDL at www.evoting.nsdl.com. The remote e-voting period commences on Tuesday, 6th August, 2024 at 09:00 a.m. (IST) and ends on Wednesday, 4th September, 2024 at 5:00 p.m. (IST). The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter and will not be allowed beyond the said date and time. Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.

For instructions related to e-voting, the members are requested to note the instructions provided in Notice.

Members whose names appear in the register of members as on 30" July, 2024 (Cut-off date) will be considered for the purpose of remote e-voting. In case of joint holders, only such joint-holder who is higher in the order of names will be entitled to vote.

The Board of Directors of the Company has appointed Ms. Ragini Chokshi of Ragini Chokshi & Co., Practicing Company Secretary (CP 1436), as Scrutinizer for conducting the Postal Ballot process in a fair and transparent

The results declared along with Scrutinizer's Report shall be placed on the Company's website www.gpelindia.in, on the website of NSDL www.evoting.nsdl.com and the same will be intimated to the stock exchange where the shares of the Company are listed, on or before Friday, 6th September, 2024. The Resolutions, if passed with the requisite majority through postal ballot, shall be deemed to have been passed, on the last date specified for remote e-voting i.e., Wednesday, 4"September, 2024. In case of any queries, you may refer to the Frequently Asked Questions

(FAQs) for Members and e-Voting user manual for Members available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 022 -4886 7000 or send a request to evoting@nsdl.com.

For Gujarat Poly Electronics Limited

Dated: 5" August, 2024

Nivedita Nambiar Company Secretary & Compliance Officer



Ujjivan Small Finance Bank

Registered Office: Grape Garden, No.27, 3rd "A" Cross, 18th Main. 6th Block, Koramangala, Bengaluru-560095, Karnataka. Regional Office: 7th Floor, Almonte IT Park, Sr.No. 8, Kharadi-Mundhwa Bypass, Village Kharadi, Pune - 411014.

POSSESSION NOTICE

NHEREAS, the authorized officer of Ujjivan Small Finance Bank, under the Securitization And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002. and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued demand notices to the borrower(s)/ Coborrower (s) calling upon the borrowers to repay the amount mentioned against the respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices within 60 days from the date of receipt of the said notices, along with future interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and/or realisation.

SI	Loan No	Name of Borrower/ Co-Borrower / Guarantor/ Mortgagor	13(2) Notice Date/ Outstanding Due (in Rs.) As on	Date & Type of Possession
1		Anubhai Dahyabhai Bhangi, Hemaben Anubhai Solanki, both are residing at Parijat Avas Auda Makan, Block no. 5, Room no. 150, 2nd Floor, Thaltej Ahmedabad, Gujarat-380058. 1) also at Ahmedabad Municipal Corporation Thaltej Jam, T-Complex AMC Office, B/H Zydus Hospital, Thaltej, Ahmedabad, Gujarat-380001. 2) also at Rudra Square, B/H. Gormor Hotel, Nr. Judge Bunglow Circle Satellite, Thaltej Ahmedabad, Gujarat-380058	18.03.2024 / Rs.17,30,731.22 as on 14.03.2024	01.08.2024 / Symbolic Possession

Description of the Immovable Property: Property bearing Flat no. A/602 on 6th Floor of Block no. A, admeasuring about 105.00 Sq.Yards i.e. 87.79 Sq.Mtrs., contruction area and 19.18 Sq.Mtrs., undivideed share area, in the scheme of known as "Su-Dev Flora", Situated at Mouje Vatva, Tal. Vatva, Dist. Ahmedabad on land bearing F.P. no. 13/2/2 of T.P. Scheme no. 80 (Vatva-VI) of Survey no. 455 & 456 in the Registration Sub-District and District of Ahmedabad-11 (Asali) which is owned by Anubhai Dahyabhai

Bhangi and Hemaben Anubhai Solanki 44672101 1) Arvind Motilal Prajapati, 04.05.2023 01.08.2024 2 30000163 2) Pushpakumari Arvind Prajapati, Both are residing at 1075/1, Luhar Sheri, Symbolic Saraspur, Ahmedabad, Gujarat - 380018 16,36,908.90 Possession & also at 1477, Nani Vasan Sheri, Near as on Post Office, Saraspur, Ahmedabad City, 02.05.2023 Saraspur, Gujarat - 380018 & also at Flat No. 303, 3rd floor, Centre Point, Nr. Jawahar Sindhi Dharamshala, Kubernagar, Ahmedabad, Ahmedabad, Gujarat- 382430 1) also at Freedom Best Choice, S.F. D/206, Arvind Mega Trade, Opp. Ashok Mill BRTS Bus Stop, Naroda Road, Ahmedabad, Gujarat - 380025.

Description of the Immovable Property: Property bearing Flat No. 303 on 3rd floor admeasuring about 43.51 sq. mts. Construction property in the scheme known as "CENTRE POINT", situated on the land bearing Consolidated City Survey No. 4435 of Sheet No. 82, in the sim of Mouje Village: Sardarnagar, Taluka: Asarva, District Ahmedabad in the District of Ahmedabad and Registration Sub-District of Ahmedabad 6(Naroda). Boundary: East - Relevant Road; West - City Survey No. 4430; North- City Survey No. 4434; South - City Survey No. 4438.

	1) Shree Medical Stores, 2) Ashokkumar Taraji Prajapati, 3) Hiraben Tarajibhai Prajapati, 4) Taraji Dharmaji Prajapati All are residing at Residential Property bearing Municipal Census no. 1262 Paiki situated at City Survey no. 1871, Mouje: Khadiya Ward-2, Taluka: City, Dist. & Sub District: Ahmedabad. 2), 3), 4) also at 1262 Shamla's Pole, Bhaiyanibhri Raipur, Near Madan Gopal's Haveli, Ahmedabad, Gujarat-380001. 1), 2) also at 898/1, Raipur Chakla, Near Chakleshwar Mahadev, Raipur, Ahmedabad-380001	08.04.2024 / Rs. 1,95,678.64 as on 02.04.2024	01.08.2024 Symbolic Possession
--	---	--	--------------------------------------

Description of the Immovable Property: Residential property bearing Municipal Census no. 1262 Paiki Situated at City Survey no. 1869 (Construction thereon First Floor 83.61.30 Sq.mtrs with UDS) & Municipal Census no. 1263/A situated at City Survey no. 1871 (Construction thereon admeasuring about 10 Sq.mtrs) Mouje Khadiya Ward-2, Taluka: City, Dist. & Sub District: Ahmedabad and bounded as East: Road, West: Passage, North: Passage, South: Backside Wall, which is owned by Haruben Taraii Praiapati

44672100 1) Rajubhai Parmar, 2) Gagubhai 30000047 Parmar, both are residing at Gharvihona Bavla Dholka, Ahmedabad, Gujarat- 382220. 1) also at Shiv Infrastructare/C/o Praween Gulati Infrastructare, NR. Baula Road Way, Pathak Bavla Ahmedabad, Gujarat-302220	18.03.2024 / Rs. 5,34,789.40 as on 13.03.2024	01.08.2024 / Symbolic Possession
--	--	---

and House No. 478, in the area known as "Vankar Vas", situated in the sim of Mouji Village: Sindhrei, Tal.: Dholka, Dist. Ahmedabad in the District of Ahmedabad and Registration Sud District of Dholka (having built up area 1083 Sq.Ft) which is bounder as under: East: Bansibhai Savjibhia Parmar, West: Parmar Vinubhai Ramabhai, North Parmar Prkashbhai Savjibhai, South: Shrimali Manubhai Natubhai AND owned bi Parmar Rajubhai Motibhai

44682101 1) Badram Ghanchi, 2) Arvina Ghanchi 02.01.2024 01.08.2024 30000370 1676/F/F, Sutariya Ni Pole, Mandvi Ni Pole, Manek Chowk, Ahmedabad, Manavi Symbolic Ni Pole, Ahmedabad, Gujarat-380001 and 28,15,098.42 Possession also at Flat no. F505 5th Floor Block F as on Dev Samruddh, Residency Near Alok 01.01.2024 Bunglows Vastral, Ahmedabad, Gujarat-382418. 1) also at Keeon D-315, Abhisek Complex-1, Asarwa Opp. Haripura Bus Stop, Ahmedabad, Gujarat-380016

Description of the Immovable Property: The immovable property bearing Flat no. F-505 (Fifth Floor) of Block no. F admeasuring 117 Sq.yard i.e. 97.83 Sq.Mtrs. Super built-up area construction and 33.23 sq.yards i.e. 27.78 sq.mtrs., undivided share in the land with common road way, common facility and common amenities use of the scheme known as "Dev Samruddh Residency" bearing Account no. 1517, Block/Survey no. 1139/16 adm. 1-06-23 he.are.sq.mtrs., Shape Rs. 9.58 paise, Draft T.P. Scheme no. 113 (Vastral), F. P. No. 107 adm. 6374 sq.mtrs. N. A. Land situate, lying and being at Mouje: Vastral, Village, Taluka Vatva, District of Ahmedabad and Sub-District of Ahmedabad-12 (Nikol) which is bounded as follows: (Towards East-Margin then Saral Dream, Toward West-Stair-Lift, Towards North-Flat no. F/504, Towards South-Block-G) which is owned by Ghanchi Badaram Galbaram

Whereas the Borrower's/Co-Borrower's/Guarantor's/ Mortgagors, mentioned herein above have failed to repay the amounts due, notice is hereby given to the Borrower's mentioned herein above in particular and to the Public in general that the authorised officer of Ujjivan Small Finance Bank has taken possession of the properties/secured assets described herein above in exercise of powers conferred on him under Section 13(4) of the said act read with Rule 8 of the said rules on the dates mentioned above. The Borrower's and Co-Borrower's/Mortgagor's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The Borrower's/Co-Borrower's/Guarantor's/ Mortgagors mentioned herein above in particular and the Public in general are hereby cautioned not to deal with the aforesaid properties/Secured Assets and any dealings with the said properties/ Secured assets will be subject to the charge of Ujjivan Small Finance Bank.

Ahmedabad

Place : Gujarat, Sd/- Authorised Officer, Date: 01.08.2024 Ujjivan Small Finance Bank



Home First Finance Company India Limited CIN: L65990MH2010PLC240703

Website: homefirstindia.com Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com

POSSESSION NOTICE

REF: POSSESSION NOTICE UNDER SUB-RULE (1) OF RULE 8 OF THE SECURITY INTEREST (ENFORECEMENT) RULES, 2002

WHEREAS the undersigned being the Authorized Officer of HOME FIRST FINANCE COMPANY INDIA LIMITED, pursuant to demand notice issued on its respective dates as given below, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred. under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 calling upon you/Borrowers, the under named to pay outstanding dues as within 60 days from the date of receipt of respective notices. You/Borrowers all, however, have failed to pay the said outstanding dues within stipulated time, hence HOME FIRST FINANCE COMPANY INDIA LIMITED are in exercise and having right as conferred under the provision of sub section (4) of section 13 of SARFAESI ACT, 2002 read with rules thereunder, taken POSSESSION of the secured assets as mentioned herein below:

S. No	Name of Borrowers/ Co-Borrowers/ Guarantors	Description of Mortgaged Property	Date of Demand Notice	Total O/s as on date of Demand Notice (in INR)	Date of possession
1.	Malave Mukesh Sudhakar, Bhagyashree Vinod Solanke	Row house no-24, Aaradhna Orchid Vibhag 2,Behind Salasar Homes, Nr. Raghuvir Residency, Haldharu Road, Surat, Gujarat, 394310	03-02-2024	10,33,391	04-08-2024
2.	Krunalbhai Shashikantbhai Vasrani, Vidhi Krunal Vasrani	Flat no A-202, 2nd Floor, Wing - A, R140/p/2/p/1, Plot no 5, Vardhman Nagar, Opp. S.R.P.Camp, B/h. Vardhman Greens, Nr. ARISE One, Off. 2nd 150Ft Ring Road, At:- Ghanteshwar, Rajkot. Tal - Dist:- Rajkot. (Gujarat) 360007	03-02-2024	32,93,309	04-08-2024
3,	Kirit Vegada, Jashuben Vegda	Flat no -604, Block no - B, Survey No 1448, FP No 73, B/h Ayodhya Appartment, Vatva, Ahmedabad, Gujarat, 382445	04-12-2023	10,03,265	04-08-2024
4.	Vishnubhai Bhil, Hemlataben Bhil	Flat No. F/610, 6th Floor, Devnandan Sankalp city, Opp- 108 Institute, Hanspura Road, Near 200 ft road, Naroda, Ahmedabad, Guiarat, 382330	03-08-2023	13,23,218	04-08-2024

The borrower having falled to repay the amount, notice is hereby given to the borrower / Guarantor and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said rule on the date

The BORROWERS/ GUARANTORS and the PUBLIC IN GENERAL are hereby cautioned not to deal with the above referred Properties/Secured Assets or any part thereof and any dealing with the said Properties/Secured Assets shall be subject to charge of HOME FIRST FINANCE COMPANY INDIA LIMITED for the amount. mentioned hereinabove against Properties/Secured Assets which is payable with the further interest thereon until payment in full. The borrower's attention is invited to the provisions of subsection (8) of Section 13 of the Act, in respect of time available to redeem the secured asset.

Date: 06-08-2024 Home First Finance Company India Limited

financialexp.epapr.in

तंत्रीश्रीनी इसमे

જેપી ન§ા પછી દેવેન્દ્ર ફડણવીસ બનશે ભાજપ અધ્યક્ષ?

જગત પ્રકાશ નઙા પછી ભારતીય જનતા પાર્ટીની કમાન કોણ સંભાળશે? આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન એવી અટકળો શરૂ થઈ છે કે મહારાષ્ટ્રમાંથી કોઈ નેતા પાર્ટીના ટોચના પદ પર કબજો કરી શકે છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. વાસ્તવમાં શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાતે ચર્ચાઓને વેગ આપ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં સુત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાર્ટી પાર્ટીના અધ્યક્ષ પદ માટે કેટલાક નામો પર વિચાર કરી રહી છે, જેમાંથી બે નેતાઓ મહારાષ્ટ્રના હોઈ શકે છે. આમાં ફડણવીસ ઉપરાંત પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેનું નામ સામેલ થઈ શકે છે. આ અંગે ભાજપ તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું હતું કે, 'મોદી સાથે તેમની પત્ની અને પુત્રી સાથેની ફડણવીસની મુલાકાતે એવી ચર્ચાઓ વધારી છે કે ભાજપનું ટોચનું નેતૃત્વ ફડણવીસને આ પદ પર રાખવા માંગે છે.' સૂત્રએ કહ્યું, 'અગાઉ સંઘ અને ભાજપ વચ્ચે નામોને લઈને મતભેદ હતા, જેના કારણે ટોચના પદ પર નિમણકો થઈ શકી ન હતી. જોકે, હવે ફડણવીસના નામ પર સર્વસંમતિ ઊભી થતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ફડણવીસ અને મોદી વચ્ચેની મુલાકાત મહત્વપૂર્ણ છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસને લઈને પાર્ટીમાં બે મત છે કે તેમને કેબિનેટમાં મંત્રી કે અધ્યક્ષ બનાવવા જોઈએ. અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે. 'ઇજીજી ફડણવીસને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે, જેથી ફડણવીસ કેન્દ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા ભજવી શકે અને તૈયાર થઈ શકે છે, કારણ કે કેન્દ્રમાં ભાજપ સરકાર તેમના માટે ગાદીનું કામ કરશે.' મહારાષ્ટ્રમાં છેલ્લી વિધાનસભા ચૂંટશીમાં અવિભાજિત શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સાથે મળીને સરકાર બનાવી હતી. આ પછી શિવસેનામાં ભાગલા પડ્યા અને મોટી સંખ્યામાં ધારાસભ્યો એકનાથ શિંદે સાથે જોડાયા. રાજ્યમાં ભાજપ અને શિંદે જૂથે સરકાર બનાવી અને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા.

દિલીપ કુમારના બંગલા પર બનેલા હાઉસિંગ પ્રોજેક્ટમાં મોટું રોકાણ

દિલીપ કુમારના આઇકોનિક બંગલાની જગ્યાએ બની રહેલ સી વ્ય બિલ્ડિંગમાં ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ ૧૫૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા દિલીપ સાહેબના આ બંગલા અંગે વિવાદ થયો હતો. આ પ્રોજેક્ટમાં ૨૦૦૦ ચોરસ ફૂટનું મ્યુઝિયમ પણ સામેલ છે, જે દિલીપ સાહેબને સમર્પિત છે. બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનો બંગલો મુંબઈના પાલી હિલ વિસ્તારમાં હતો. ગત વર્ષે તેને તોડીને તેની જગ્યાએ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે આ પ્રોજેક્ટમાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. દિલીપ કુમારના આઇકોનિક બંગલાની જગ્યાએ બની રહેલી આ સી-વ્યૂ બિલ્ડિંગમાં ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ ૧૫૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા દિલીપ સાહેબના આ બંગલા અંગે વિવાદ થયો હતો. રિયલ એસ્ટેટ પોર્ટલ સ્ક્વેર ફીટ ઈન્ડિયા અનુસાર, દિલીપ સાહબના બંગલાની જગ્યાએ બનેલા હાઉસિંગ પ્રોજેક્ટમાં ટ્રિપ્લેક્સ ૧૫૫ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો છે. ઈમારતના ૯મા. ૧૦મા અને ૧૧મા માળે ફેલાયેલ આ ટિપ્લેક્સ એપ્કો ઈન્ળાટેક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યું છે અને તેને વેચનારી કંપનીનું નામ બ્લેકરોક છે. ૯,૫૨૭.૨૧ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા ધરાવતા આ એપાર્ટમેન્ટનો પ્રતિ ચોરસ ફૂટનો દર આશરે રૂ. ૧.૬૨ લાખ છે, જે તેને મુંબઈની સૌથી મોંઘી મિલકતોમાંની એક બનાવે છે. આ મિલકતની નોંધણી માટે રૂ. ૯.૩૦ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચુકવવામાં આવી છે. ૨૦૧૬માં દિલીપ કુમારે તેનો પાલી હિલ બંગલો તોડીને ત્યાં લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવા માટે અશર રૂપ સાથે કરાર કર્યો હતો. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નામ 'ધ લિજેન્ડ' છે અને તેમાં ૪ અને ૫ મૐદ્ભ લક્ઝરી એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં ૨૦૦૦ ચોરસ ફૂટનું મ્યુઝિયમ પણ સામેલ છે, જે દિલીપ સાહેબને સમર્પિત છે. ૨૦૨૩ માં, ડેવલપરે જાહેરાત કરી હતી કે 'ધ લિજેન્ડ' બિલ્ડિંગમાં ૧૫ લક્ઝરી એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. અગાઉ એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ પ્રોજેક્ટ ૨૦૨૭માં પૂર્ણ થશે અને તેનાથી લગભગ ૯૦૦ કરોડ રૂપિયાની આવક થશે.

બૅન્ડનાં ઘણા નવા ગીતો આવી રહ્યા છે : સુધાંશુ

એક ડબ આર્ટિસ્ટ, મોડેલ અને ટેલિવિઝન એક્ટર તરીકે કામ કર્યા બાદ સુધાંશુ બૅન્ડ ઓપ બોચ્ઝમાં જોડાયો હતો. ૨૦૦૧માં આ બૅન્ડ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સુધાંશુ સાથે કરણ ઓબેરોય, સિદ્ધાર્થ હલદીપુર, શિરીન વગીઝ અને ચિંદુ ભોંસલે હતા. જોકે, ૨૦૦૫માં આર્થિક કારણોસર તેણે બૅન્ડનો સાથે છોડી દીધો. ત્યાર બાદ દરેકના જીવનમાં ઘણી ઉથલ પાથલ થઈ અને બૅન્ડ વિખેરાઈ ગયું. પરંતુ ૨૦૧૮માં પરીથી બૅન્ડને પુનજીવન મળ્યું. ૨૦૧૮માં કરણ, શિરીન અને ચિંચુ પરી મળ્યા, તેમની સાથે ડેની ફર્નાન્ડીઝ પણ જોડાયો. પાછળથી સિદ્ધાર્થ પણ તેમની સાથે જોડાઈ ગયો. આ વર્ષની શરૂઆતમાં સુધાંશુએ એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેની સાથે તેના બૅન્ડ મેમ્બર્સ પણ હતાં. બૅન્ડના ૨૩ વર્ષ પૂરાં થતાં તેમણે એક રીયુનિયન યોજ્યું હતું. હાલ તો સુધાંશુ ટીવી પર અનુપમા સિરીયલથી ઘર ઘરમાં જાણીતો થયો છે. ત્યારે તેના બૅન્ડમાં જોડાવા પર તેણે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી છે. ''અમે હવે આખરે બધાં જ ફરી મળી ગયા છીએ. હવે અમે બધાં જીવનમાં એવા પડાવ પર છીએ કે અમે કંઈ પણ કરીએ તો ચાલે એવું છે, તો અમે બૅન્ડ ફરી શરૂ કરવાનું વિચાર્યુ છે અને હવે ઘણા ગીતો લઇને આવી રહ્યા છીએ.'' આ બૅન્ડની શરૂઆત બાબતે સુધાંશુએ જણાવ્યું હતું, ''એ વખતે અમે બધાં ૨૦ વર્ષની આસપાસની ઉંમરના હતા અને એ વખતે અમે બધાં જ મુંબઈમાં અમારું સ્થાન બનાવવા પ્રયત્નો કરતા હતા. અમે બધાં અલગ અલગ નાના શહેરોનાં મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હતાં. કરોડોની સંપતિનો ટેકો કરનારું અને કોઈ ગોડફાધર પણ ન હતું. '' સુધાંશુએ આગળ કહ્યું, ''ત્યારે તમારે તમને જેવા અનુભવો મળે તેના આધારે જ જીવન જીવવાનું હોય છે. મને જીવને જ સૌથી વધુ શીખવ્યું છે. મારી કરિયરની શરૂઆત તો સારી થઈ, પણ હું કંઈ જ વિચાર્યા વિના બૅન્ડમાં જોડાવા કૂદી પડ્યો. ત્યારે હું યુવાન હતો, બધી સમજ નહોતી" બૅન્ડ સાથે ફરી જોડાવા અંગે સુદ્ધાંશુએ કહ્યું, "બેન્ડ સાથે ત્રણ સાડા ત્રણ કે ચાર વર્ષ રહ્યાં પછી મને આ વાત સમજાઈ કે મેં બૅન્ડના કારણે કેટલી બધી તકો ગુમાવી છે. એ પહલાં હું એક્ટિંગ કરતો હતો." સુધાંશુએ ૨૦૦૦માં અક્ષય કુમાર સાથે 'ખિલાડી ૪૨૦'માં કામ કરીને ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી.

મોબાઈલનું વળગણ શિક્ષિત યુવા પેઢીને ગેરમાર્ગે દોરે છે

મોબાઈલનું વળગણ કેટલી હદે ગોતા ગયા હતા. લઈ જાય છે તેનો જીવંત નમૂનો તાજેતરમાં જ સામે આવ્યો છે. આજની યુવા પેઢી બીજા કામો કરતાં પોતાનો વધારે સમય મોબાઈલ પાછળ જ વ્યતીત કરતી જોવા મળે છે. તેના પરિણામના કિસ્સા રોજે નાગરેચા બોડકદેવમાં આવેલા સામે આવતા હોય છે. તાજેતરમાં જ શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ૨હીને શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો હતો જેમાં એક શિક્ષિત સાધન સંપન્ન ૨૫મીએ બંને પતિ પત્ની કામે ગયા પરિવારનો દીકરો મોબાઈલના વળગણને પરિણામે ચોરી કરવા બે તોલાના સોના અને ચાંદીના ફરજ બજાવે છે. વેબસાઇટ પર લાગ્યો હોવાનું સામે આવ્યું હતું. બનાવની વિગત મુજબ બીએ પાસ થયેલો નવયુવાન ઓનલાઈન ગેમમાં હતા. દેવું થતા ચોરી કરવાના માર્ગે દોરાયો હોવાની માહિતી સામે આવી હતી.

શહેરના વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ચોરીની ઘટના સામે આવી રહી છે, જેમાં અત્યાર સુધી ત્રણ દિવસમાં કુલ રૂ. ૪.૪૫ લાખની ચોરીઓની ઘટનાને લઇને વસ્ત્રાપર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.પોલીસને આ ત્રણે બનાવોની સીસીટીવી ફ્ટેજ મળી આવતા આરોપીની ઓળખાણ કરવામાં પણ સફળતા મળી હતી. અને પોલીસ દ્વારા તરતજ એક્શન લઇને એક નવયુવાનની ધરપકડ પણ કરવામાં આવી હતો. પકડાયેલો આરોપી મહિલા છજીંનો પુત્ર હોવાની વિગતો મળી છે.જેને ઓનલાઇન ગેમ રમવામાં દેવું થઇ જતા તેણે વેબ સિરિઝ જોઇને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

બોડકદેવમાં અકીક ટાવરની પાછળ આવેલા શુભ શાંતિ વિભાગમાં રહેતા દર્શકભાઇ સોની પ્રિન્ટિંગનો વેપાર કરે છે. તેઓ .૨૫મીએ ઓફિસ ગયા હતા અને પત્ની પણ કામે બહાર ગયા હતા. રાત્રે બંને ઘરે આવ્યા ત્યારે ફ્લેટનું તાળું તુટેલું હતું ,મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ. ૨ લાખની ચોરી થઇ હતી. જ્યારે અન્ય બનાવ વસ્ત્રાપુરના પલક એવન્યુમાં રહેતા હેતલબેન નાયક ઘરને તાળું

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની ભલામણોનો ગુજરાત વિદ્યાપીઠમાં અમલ થશે

અમદાવાદ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની ભલામણોનો ગુજરાત વિદ્યાપીઠમાં અમલ થશે. રાષ્ટ્રીય નીતિ ૨૦૨૦ની ભલામણોનો ગૂજરાત વિદ્યાપીઠમાં કઈ કઈ રીતે અમલ કરવામાં આવ્યો છે તે અંગેની એક આકારણી બેઠક આજરોજ ઉચ્ચ શિક્ષણમાં કાર્યરત સૌ અધ્યાપકોની સાથે કુલપતિ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં હિરક મહોત્સવ ખંડમાં યોજાઈ ગઈ.આ બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના ગૂજરાત વિદ્યાપીઠમાં અમલીકરણ માટેના નોડલ ઓફિસર ડો. દિપુબાએ ઉચ્ચ શિક્ષણમાં એ તમામ કાર્યો અને વિભાગો અંગે વિસ્તારથી જણાવ્યું જેમાં ગૂજરાત વિદ્યાપીઠે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના સ્થનોનો અમલ કર્યો છે. કુલપતિ ડો. હર્ષદભાઈએ આ અંગે અભિનંદન આપ્યા અને આનંદ વ્યક્ત કર્યો હતો.

એ સમયે તેમના મકાન માંથી ચોરે લોખંડની તિજોરીનું લોકર તોડીને રૂ. ૧.૧૧ લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. અન્ય એક ઘટનામાં રાજકોટના મયુરભાઇ સ્કીનની દવાનો વેપાર કરે છે. લાખની મતા ચોરી ફરાર થઇ ગયા

પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ કરતા એક આરોપીની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. એલ. ચાવડા અને પીએસઆઇ આર. એલ.

ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે તપાસ કરતા યવરાજની માતા શહેર પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. અને આરોપીએ બીએ પાસ હોવાનું સામે આવ્યું હતું. પણ ઓનલાઇન ગેમ રમવામાં દેવું થઇ જતા તેણે આ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

આરોપી યુવરાજ ભક્ર જીવરાજપાર્ક વિસ્તારમાં રહે છે. હતા તે સમયે કબાટમાંથી તસ્કરો સવા 💮 જ્યારે તેની માતા પોલીસ વિભાગમાં દાગીના મળી કુલ રૂ. ૧.૩૨ ઓનલાઇન ગેમ રમવામાં દેવું થઇ જતા તેણે મની હાઇસ્ટ સિરિઝ જોઇને ચોરીનું પ્લાનિંગ કર્યું હતું. જે અંતર્ગત આ ત્રણે મામલે વસ્ત્રાપુર બપોરે જે બંધ ઘર હોય તેને ટાર્ગેટ કરવા માટે મોઢે રૂમાલ બાંધીને પાનાથી તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. તે મુજબ હાલ ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા છે, જ્યારે વધુ ચોરી કરી છે પટેલની ટીમે યુવરાજ ભટ્ટ (ઉ.૨૧, કે કેમ તેની તપાસ હજી પોલીસ દ્વારા જીવરાજપાર્ક)નામના કરવામાં આવી રહી છે .

પનામા પેટ્રોકેમ લીમીટેડ

રજી. ઓફિસ : પ્લોટ નં. ૩૩૦૩, જેઓઈડીસી એસ્ટેટ, અંકલેશ્વર: ૩૯૩૦૦૨ . **કોર્પો.ઓફિસ**: ૪૦૧ , અઝા હાઉસ-૨૪ ટર્નર રોડ, બાંદ્રા (ડબ્લ્યુ) , મુંબઈ, મહારાષ્ટ્ર- ૪૦૦૦૫૦ વેબસાઇટ www.panamapetro.com CIN No. : L23209GJ1982PLC005062 ફોન - ૯૧-૨૨-૪૨૧૭૭૭૭, ઈ-મેલ : cs@panamapetro.com

એજીએમ અને ઈ- વોટિંગ ની નોટીસ

ખાથી અહી નોટીસ આપવામાં આવે છે કે કંપનીએ ૪૨મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)ની વીડીઓ કોન્ફરન્સીંગ (વીસી) અથવા બીજી તરફ ઓડીયો વિજયુઅલ મીન્સથી (ઓએવીએમ)ગુરૂવાર, ૨૯મી ઓગષ્ટ**, ૨૦૨૪ ના રોજ સવારે ૧૧.૩૦ વાગે** જે કંપનીઝ અધિનિયમ, ૨૦૧૩ ની લાગુ જોગવાઈઓ અને સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)(લિસ્ટીંગ ઓબ્લીગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ) રેગ્યુલેશન ૨૦૧૫ના પાલનમાં તમામ લાગુ પરિપત્રો સાથે વંચાણે લેતા તથા કોર્પોરેટ અફર્સ મંત્રાલય (એમસીએ) દ્વારા અને સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા જારી કરવામાં આવેલી બાબત પર, એજીએમ બોલાવતી નોટિસમાં નિર્ધારિત વ્યવસાયનો વ્યવહાર કરવા માટે. VC/OAVM સુવિધા દ્વારા ભાગ લેનારા સભ્યોને કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ કોરમના હેતુ માટે ગણવામાં આવશે.

સબંધિત સરક્યુલર અને સેબી સરક્યુલરનું પાલન કરતા આ નોટિસની સાથે વાર્ષિક અહેવાલ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ અન્ય બાબતોની સાથે, તમામ સભ્યોને તેમના ડીપોઝીટરી પાર્ટીસીપેટ પાસે નોંધાયેલા ઇમેઇલ આઇ ડી પર ૦૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ પુરી કરવામાં આવેલ છે.ઉપરોક્ત દસ્તાવેજ કંપનીની વેબસાઇટ www.panamapetro.com અને સ્ટોક એક્સચેન્જ જેમકે, બીએસઈ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ એટ www.bseindia.com and www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.એજીએમની નોટીસ સીડીએસએલ ની વેબસાઇટ **www.evotingindia.com** પર પણ

કંપનીઝ એકટ ૨૦૧૩ ની કલમ ૧૦૮ ની જોગવાઈ ને કંપનીઓના વ્યસ્થાપન અને વહિવટ નિયમો, ૨૦૧૪ ના સુધારેલા નિયમ ૨૦ સાથે વાંચતા અને સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશનઅને ડિસ્ક્લોઝર રિક્વાયરમેંટ) રેગ્યુલેશન, ૨૦૧૫ ના નિયમ ૪૪ હેઠળ, કંપની એ એજીએમ દરમ્યાન સભ્યો ને રીમોટ ઈ- વોટીંગ અને ઈ-વોટીંગ ની સવલત એજીએમ અને તેના ઉદ્દેશ્યો ના બિઝનેસના વ્યવહાર કરવા માટે ઇલેક્ટ્રોનિક મતદાન માટે સીડીએસએલ ની નિમણુંક કરેલ છે. વોટિંગ કરવાની પદ્ધતી નીચે મુજબ છેઃ

- રીમોટ ઈ-વોટિંગીનો દિવસ તારીખ અને સમય સોમવાર, ૨૬ ઓગષ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ વાગ્યા થી બુધવાર, ૨૮ ઓગષ્ટ, ૨૦૨૪ ના સાંજે ૫.૦૦ ક્લાકે પુરો થશે,તે પછી રિમોટ વાર્ટિંગ બંધ કરી દેવામાં આવશે.
- ૪૨મી એ.જી.એમની નોટિસમાં દર્શાવ્યા મુજબના ઠરાવો પર કંપની એ રિમોટ ઇવોટીંગની તેમજ એજીએમ દરમ્યાન ઇ વોટીંગની સગવડ આપી છે
- યોગ્ય સભ્યો કટ-ઓફ તારીખ ૨૨ ઓગસ્ટ. ૨૦૨૪ની રહેશે.
- જો કોઈ વ્યક્તિ વાર્ષિક સાધારણ સભાની નોટિસ આપ્યા પછી અને કટ-ઓફ તારીખ જેમ કે ૨૨ ઓગસ્ટ. ૨૦૨૪ ના પહેલા કંપનીના શેર ખરીઘા હોય અને કંપનીના સભ્ય બન્યા હોય તો તેઓ એજીએમ નોટીસમાં દર્શાવ્યા માર્ગદર્શિકા, યુઝર આઇડી અને પાસવર્ડ સહીત વોટ આપી શકે
- કોઈપણ સભ્ય જે એજીએમમાં વીસી મારફતે હાજર હોય અને રીમોટ ઇ વોટીંગ ન કર્યું હોય અને આ બાબતે પ્રતિબંધિત ના હોય તે સભ્ય એજીએમ દરમ્યાન મતદાન કરી શકે છે. એજીએમ પુર્ણ થયા બાદ ૧૫ મિનીટ બાદ ઈ- વોટીંગ ની સિસ્ટમ બંધ થઈ જશે
- ડિપોઝીટરી દ્વારા બેનીફિશ્યરી ઓનર ના જે વ્યક્તિનું નામ સભ્ય તરીકે કટ ઓફ ડેટ સુધી નોંધાયુ હોય તે એજીએમમા રિમોટ ઈ- વોટીંગ કે ઈ- વોટીંગ કરવા લાયક છે.
- જે સભ્યો રીમોટ ઈ-વોટિંગ દ્વારા પોતા નો મત આપ્યો હોય તેઓ એજીએમ માં હાજર રહી શકશે પરંતુ કરીથી મતદાન કરી શકશે નહી.
- ઈમેઇલ એડ્રસ રજીસ્ટર ન કરાવ્યા હોય તેમને એજીએમની નોટીસમાં માહિતી આપી છે. અને તેની વિગતવાર માહિતી કંપનીની વેબસાઇટ પર છે, સભ્યોને વિનંતી છે કે આ માહિતી માટે www.panamapetro.com પર જવું . એજીએમ ની નોટિસ કંપની વેબસાઇટ www.panamapetro.com અને સીડીએસએલ વેબસાઇટ

સભ્યો એ જે ડિમેટાઇઝેશન/ફ્રીઝિકલ મોડમાં શેર ધરાવે છે તે મનો રીમોટ- ઈ વોટીંગ કેવી રીતે કરવું તે અને

www.evoting.com પર અપલોડેડ છે. ૦. કોઈ પણ રિમોટ ઈ- વોટિંગ સભ્ય જાણકારી માટે સંપર્ક શ્રી રાકેશ દલવી, મેનેજર સીડીએસએલ, એ વિન્ગ

૨૫માં માળ, મેરાથન ફ્યુચરેક્ષ, મફતલાલ મિલ કમ્પાઉન્ડ, એન.એમ. જોશી માર્ગ લોઅર પરેલ (ઈસ્ટ) મુંબઈ-૪૦૦૦૧૩ અથવા ટોલફ્રી નં. ૧૮૦૦૨૨૫૫૩૩, ઈ-મેલ helpdesk.evoting@cdslindia.com પર સંપર્ક

અપડેટીંગ ઈમેઇલ એડ્સ અને નોંધણીની પદ્ધતિ

એ) ફ્રીઝિકલ પદ્ધતીએ શેર ધરાવતા હોય તે સભ્યોએ કંપની પાસે ઈ-મેઇલ એડ્રેસના નોંધાયેલ હોય તો તેમણે અપડેટ કરાવી લેવા, આ અપડેટ વેબસાઇટરંtps//www.panamapetro.com.wp-content//uploads/ 2023/05/from.ISR-1p.pdf અને અમારી આરટીએ વેબસાઇટ બીગ શેર સર્વિસેઝ પ્રા. લિ. એટ https:/ www.bigshareonline.com/Resources.aspx પર દર્જ કરાવવું.

બી) ડિમીટાઇજેશન શેર ધરાવતા હોય તે સભ્યોએ ડિપોઝિટરી પાર્ટીસિપેટ સાથે નોંધણી અને ઈ-મેઇલ અપડેટ ન કરાવ્યા હોય તેમણે ડિમેટ એકાઉન્ટ મેઇન્ટેઇન કરતા ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટ સાથે અપડેટ કરાવી લેવં .

પનામા પેટ્રોકેમ લીમીટેડ વતી

સ્થળ : મુંબઈ તારીખ : ૦૫ ઓગસ્ટ, ૨૦૨૪.

ગાયત્રી શર્મો કંપની સેક્રેટરી અને કમ્પ્લાંયસ ઓફિસર



Place: Ahmedabad

RADHE DEVELOPERS (INDIA) LIMITED

Regd. Office: Radhe Acres, Block No.-220,226 & 227,B/h. Applewoods Township, Shela, Ahmedabad-380058 CIN: L45201GJ1995PLC024491 | Website : www.radhedevelopers.com
Phone: +91 79-26583381/2 | Fax: +91 79-26585567 | E-mail: secretarial@radheinfra.com

EXTRACT OF THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024 (Rs. in lakhs except per share data)					
Sr. No.	Particulars	Quarter ended	Year ended	Quarter ended	
		30/06/2024	31/03/2024	30/06/2023	
		Un-Audited	Audited	Un-Audited	
1	Revenue from operations	20.00	676.47	124.69	
	Net Profit / (Loss) for the period	(102.22)	(455.20)	(50.03)	
2	(before Tax, Exceptional and/or Extraordinary items)	(102.33)	(455.38)	(58.02)	
3	Net Profit / (Loss) for the period before Tax	(102.22)	(455.38)	(50.03)	
3	(after Exceptional and/or Extraordinary items)	(102.33)		(58.02)	
4	Net Profit / (Loss) for the period after Tax	(101.00) (463.6	(462.61)	(52.42)	
4	(after Exceptional and/or Extraordinary items)	(101.86)	(462.61)	(53.12)	
5	Total Comprehensive Income for the period	(101.86)	(461.66)	(53.12)	
6	Paid up Equity Share Capital (Face value of ₹ 10/- each)	5035.98	5035.98	5035.98	
7	Other Equity excluding revaluation reserves				
8	Earnings Per Share (of ₹ 1/- each)				
	(for continuing & discontinued operations)				
	a) Basic	(0.02)	(0.09)	(0.01)	
	b) Diluted	(0.02)	(0.09)	(0.01)	

The above is an extract of the detailed format of Financial Results for the quarter ended June 30, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the said Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company's website

In line with Ind AS - 108 Operating Segments and basis of the review of operations being done by the Senior Management the operations of the Company fall under the Construction business which is considered to be the only reportable segment

> For, Radhe Developers (India) Limited Ashish Patel

દૂરબીનથી જોયું, પણ બજેટમાં ક્યાંય અયોધ્યાનું નામ નથી

કરતી ભાજપ સરકારે કેન્દ્રીય બજેટમાં દેશના સૌથી મોટા ધાર્મિક સ્થાન. ભગવાન શ્રીરામના જન્મસ્થાન અયોધ્યા રામમંદિર માટે પણ કોઈ જોગવાઈ નથી. લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, આ બજેટમાં અયોધ્યાની પણ અવગણના કરવામાં આવી છે.

અવધેશ પ્રસાદે ગૃહમાં કહ્યું, 'હું મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રની ભૂમિથી આવ્યો છું. હું અશફાકુલ્લા ખાનની ભમિમાંથી આવ્યો છું. મેં નાણામંત્રીનું બજેટ ઘણી વખત દૂરબીનથી જોયું, પરંતુ તેમાં અયોધ્યાનું નામ નથી. તે ભગવાન શ્રી રામની અયોધ્યા છે. પરંતુ ભાજપે તેના નામે રાજનીતિ અને ધંધો કર્યો છે. સપા સાંસદે કહ્યું કે, ભાજપે અયોધ્યાના વિકાસને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. કારણ કે હું દલિત જાતિનો છું અને અમારા નેતા અખિલેશ યાદવે મને જનરલ સીટ પરથી ટિકિટ આપી હતી. તેથી ૨૨ જાન્યુઆરીથી લઇને ચૂંટણી સુધી દેશના

રામની કૃપા મારા પર હતી, તેથી તે ગુજારવામાં આવ્યો હતો.

નવી દિલ્હી, હિન્દુ રાષ્ટ્રની વાત ખૂણે-ખૂણેથી લોકો અવધેશ પ્રસાદને લોકોને નકારવામાં આવ્યા કારણ કે. હરાવવા આવ્યા હતા પરંતુ ભગવાન અયોધ્યાના લોકો પર અત્યાચાર

ફોર્મ નંબર INC-26

(કંપનીઝ (ઇન્કોર્પોર્ટેશન) નિચમો, ૨૦૧૪ ના નિચમ ૩૦ હેઠળ)

કેન્દ્ર સરકાર / પ્રોદેશિક નિયામક (ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર) અમદાબાદ, ગુજરાત સમક્ષ કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૩(૪) અને કંપનીઝ (ઇન્કોર્પોરેશન) નિચમો, ૨૦૧૪ ના

ਰਿਕਮ 3o(ਪ) ਗ કલમ (એ) ਫੇਠળ

શેખાવતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ફોરમેરલી શેખાવતી પોલી-ચાર્ન લિમિટેડ), જેની નોંધણી ઓફિસ પ્લોટ નંબેર. ૧૮૫/૧, નેરોલી ગામ, કનડી ફાટક ની પાસે, નરોલી, દાદરા નગર હવેલી - ૩૯૬૨૩૫, ગુજરાત અવલે છે, ની બાબતમાં

અત્રે જહેર જનતાને નોટિસ પાઠવવાની કે કેન્દ્ર સરકારને કંપનીને કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૩ હેઠળ કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના ફેરફારની પુષ્ટી માટે વિશેષ ઠરાવ પસાર જુલાઈ ૨, ૨૦૨૪ ના રોજ ચોજાચેલી અસાધારણ જનરલ મીટિંગમાં કંપનીની નોંધણી કચેરી . ગુજરાત રાજ્ય" થી "મહારાષ્ટ્ર રાજ્ય" માં બદલવા માટે પસાર કરેલ છે.

કોઈપણ વ્યક્તિ જેના હિત કંપનીની નોંધણી કચેરીના પ્રસ્તાવિત ફેરફારથી અસરપાત્ર થવાર્ન સંભાવના છે તે MCA-21 પોર્ટલ (www.mca.gov.in) પર રોકાણકાર કમ્પ્લેઇન્ટ ફોર્મ ભરીને ખુંથવા રિજસ્ટર્ડ પોસ્ટ દ્વારા તેના/તેણીના હિતના અને વિરોધના કારણો સોંગંદનામાં દ્વારા આ નોટિસ પ્રકાશિત થવાના તારીખથી ૧૪ દિવસની અંદર પ્રાદેશિક નિયામક. આર્ઓની ભવન નારણપુરા, અમદાબાદ - ૩૮૦૦૧૩ ના સરનામે અને અરજદાર કંપનીની નોંધણી કરોરી ખાટે અરજદાર વતી અને તરકર્થ

શેખાવતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કોરમેરલી શેખાવતી પોલી - ચોર્ન લિમિટેડ

मुडेश रामनिरंदन रूछया અધ્યક્ષ અને મેનેજિંગ સંચાલક डिन : ००३७२०८३

SHRIRMM HOUSING FINANCE

ડીમાન્ડ નોટીસ

શ્રીરામ હાઉસીંગ ફાયનાન્સ લિ.

રજીસ્ટર્ડ ઓફિસ : ઓફિસ નં. ૧૨૩, અંગપ્પા નાઈકેન સ્ટ્રીટ, ચેન્નાઈ-૬૦૦૦૦૧. હેડ ઓફિસ: લેવલ - ૧, વોકહાર્ટ ટાવર્સ, પૂર્વ વિંગ, સી-૨, બ્લોક - જી, બાન્દ્રા-કુરલા કોમ્પ્લેક્ષ, મુંબઈ-૪૦૦૦૫૧. વેબસાઈટ : www.shriramhousing.in

જયારે ઉધારકર્તાઓ / સહ - ઉધારકર્તાઓ / જામીનદારો / અહી ઉલ્લેખિત શ્રીરામ હાઉસીંગ ફાઈનાન્સ લિમીટેડ પાસેથી નાણાંકીય સહાયનો લાભ લીધો હતો. અમે જણાવીએ છીએ કે નાણાંકીય સહાયનો લાભ મેળવ્યો હોવા છતાં, ઉધારકર્તાઓ / જામીનદારોને નિયત તારીખો મુજબ વ્યાજ અને મુદતની રકમની ચુકવણીમાં વિવિધ ક્ષતિઓ કરી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા જારી કરાયેલા નિર્દેશો / માર્ગદર્શિકા અનુસાર ખાતાને બિન - કાર્યવાહી મિલકત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યુ છે, જેના પરિણામે શ્રીરામ હાઉસીંગ ફાઈનાન્સ લિમીટેડ ના અધિકૃત અધિકારીને નાણાંકીય અસ્કયામતોનું સિકયોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ના નિયમ - ૩ સાથે વાંચેલી કલમ ૧૩(૨) હેઠળ આપવામાં આવેલી સત્તાના ઉપયોગ માટે સરફેસી અધિનિયમ ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ ઉધારકર્તાઓ / જામીનદારોને નીચે દર્શાવેલ સંબંધિત તારીખો પર ડીમાન્ડ નોટીસ જારી કરી, નીચેના ઉધારકર્તાઓને નોટીસ દ્રારા જાણ કરવામાં આવે છે કે ઉલ્લેખિત રકમ અને આકસ્મિક ખર્ચ, કોસ્ટ, ચાર્જીસ વગેરે સાથે નોટીસ મળ્યાના ૬૦ દિવસની અંદર રકમ ચુકવવા જણાવેલ ત્યાર બાદ રકમના કરારના દરે વ્યાજ સાથે રકમ ચુકવવા જણાવેલ. નોટીસ તેમને તેમના છેલ્લા જાણીતા સરનામાં પર જારી કરવામાં આવી છે અને આથી તે અંગે જાહેર સુચના દ્રારા જાણ કરવામાં આવી છે. અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં

સ્થળ : દાદરા નગર હવેલી

તારીખ : ૦૫/૦૮/૨૦૨૪

પેટા કલમ (૮) તથા કલમ ૧૩ સરફેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલક	તના બાકી લ્હેણાં ભરપ	ાઈ કરી પાછી મેળવી શકો છો.
ઉદ્યારકર્તાઓ અને સહ-ઉદ્યારકર્તાનું નામ	બાકી લ્હેંણી રકમ	મુક્સ્ટ મિલકતનું વર્ણન
(૧). મલેક મોહ્મ્મદભાઇ એમ, હાલનું સરનામું :- બી-૧૧, જેહાન પાર્ક, મરીડા રોડ, મું. નડીયાદ, નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૨ અને અહીં પણ : મલેક મોહ્મ્મદભાઇ એમ, બિઝનેસ સરનામું :- સાંઈ બાબા વેલ્ડીંગ વર્કસ, વોર્ડ નં. ૭, ઘર નં. ૧૯૧૪/૫, પપીંગ સ્ટેશનની પાસે, મરીડા ભાગોળ, નડીયાદ, નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૧. અને અહીં પણ : મલેક મોહ્મ્મદભાઇ એમ, મિલકતનું સરનામું :- પ્લોટ નં. બી/૧૧/૪, જેહાન પાર્ક, અદનાન પાર્કની પાસે, મરીડા રોડ, નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૨. અને અહીં પણ : મલેક મોહ્મ્મદભાઇ એમ, કાચમી સરનામું :- બી-૩, રોશન પાર્ક, મરીડા પાર્ક, મું. નડીયાદ, નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૨. (૨). મલેક સૈદાબાનું મોહ્મ્મદભાઇ, હાલનું સરનામું :- બી-૧૧, જેહાન પાર્ક, મરીડા રોડ, મું. નડીયાદ, નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૨ અને અહીં પણ : મલેક સૈદાબાનું મોહ્મ્મદભાઇ, મિલકતનું સરનામું :- પ્લોટ નં. બી/૧૧ પૈકી, સબ પ્લોટ નં. બી/૧૧/૪, જેહાન પાર્ક, અદનાન પાર્કની પાસે, મરીડા રોડ, નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૨. અને અહીં પણ : મલેક સૈદાબાનું મોહ્મ્મદભાઇ, કાચમી સરનામું :- બી-૩, રોશન પાર્ક, મરીડા પાર્ક, મું. નડીયાદ, નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૨. અને અહીં પણ : મલેક સૈદાબાનું મોહ્મ્મદભાઇ, કાચમી સરનામું :- બી-૩, રોશન પાર્ક, મરીડા પાર્ક, મું. નડીયાદ, નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૨. અને અહીં પણ : મલેક સૈદાબાનું મોહ્મ્મદભાઇ; કાચમી સરનામું :- બી-૧૧, જેહાન પાર્ક, મરીડા રોડ, મું. નડીયાદ, નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૨ અને અહીં પણ : મોલ્મ્મદલનીફ મલેક, હાલનું સરનામું :- બી-૧૧, જેહાન પાર્ક, મરીડા રોડ, મું. નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૨ અને અહીં પણ : મોલ્મ્મદલનીફ મોલ્મ્મદલનીફ મોલક, મિલકતનું સરનામું :- પ્લોટ નં. બી/૧૧ પૈકી, સબ પ્લોટ નં. બી/૧૧/૪, જેહાન પાર્ક, અદનાન પાર્કની પાર્સ, મરીડા રોડ, નડીયાદ, ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૨. એનપીએ તારીખ : ૦૪.૦૦.૨૦૨૪	રૂા. ૫૯,૩૦૨/- (રૂા. ઓગણસાહીઠ હજાર ત્રણસો બે પુરા) તા. ૦૬.૦૭.૨૦૨૪ ના સુધીના, વત્તા ચડત વ્યા સાથે, લોન એકાઉન્ટ નં. SHLHVDDR 0000709 લોન અને સ્ક્રમ SHLHVDDR 0000709 રૂા. ૭,૪૭,૦૨૩/-	તમામ ભાગ અને હિસ્સ સાથેની બીન ખેતીલાય: મિલકત મોજે - નડીયાદ ચકલાસી પાર્ટીની પાસે નડીયાદ, ખેડા, જમીનનં આર. એસ. નં. ૧૯૧૩/૨ જેહાન પાર્ક થી જાણીતં એરીયા, પ્લોટ નં. બી/૧૧ પેકી, સાબ પ્લોટ નં બી/૧૧/૪, ક્ષેત્રફળ ૪૩૯ સ્કે.મી., બિલ્ટ અપ એરીયા, ક્ષેત્રફળ ૧૮૮ સ્કે. ફીટ. અને ૨૭૨ટ્રેશન જીલ્લો અને સબ્જીલ્લો - નડીયાદ, જીલ્લો ખેડા. ચતુઃસીમા :- ઉત્તરે : સબ્પલોટ નં. બી/૧૧/૮, દક્ષિણ પ્લોટ નં. બી/૧૧/૮, દક્ષિણ પ્લોટ નં. બી/૧૧/૮, વર્ષા ૭.૫૦ મી. સોસાયટી રોડ પશ્ચિમ : સબ પ્લોટ નં બી/૧૧/૮.
(૧). મુંજપરા બિજલ પ્રદિપભાઇ, હાલનું સરનામું :- બી-૨/૫૦૨, અભિનંદન રેસીડેન્સી, ઉત્રાણ ગરનાળાની પાસે, ઉત્રાણ, સુરત, ગુજરાત - ૩૯૪૧૦ અને અહીં પણ : મુંજપરા બિજલ પ્રદિપભાઇ, મિલકતનું સરનામું :- ફલેટ નં. સી-૩૦૨, ત્રીજો માળ, સી - બિલ્ડીંગ, ઓમકાર એવન્યુ, બ્લુ હોરીઝોન ની બાજુમાં, સહજાનંદ સ્કર્વેરની સામે, જુનો કોસાડ રોડ, કોસાડ, સુરત, ગુજરાત - ૩૯૪૧૦૭. (૨). મુંજપરા પ્રદિપભાઇ હસમુખભાઇ, હાલનું સરનામું :- બી-૨/૫૦૨, અભિનંદન રેસીડેન્સી, ઉત્રાણ ગરનાળાની પાસે, ઉત્રાણ, સુરત, ગુજરાત - ૩૯૪૧૦ અને અહીં પણ : મુંજપરા પ્રદિપભાઇ હસમુખભાઇ, બિઝનેસનું સરનામું :- માં એન્ટરપ્રાઈઝ, દુકાન નં. ૧૩૪ / ૧૩૫ / ૧૩૬,	રૂા. ૨૪,૧૬,૪૪૮/- (રૂા. ચોવીસ લાખ સોળ હજાર ચારસો અડતાલીસ પુરા) તા. ૦૬.૦૭.૨૦૨૪ ના સુધીના, વત્તા ચડત વ્યા સાથે, લોન એકાઉન્ટ નં. SHLHSRAT	તમામ ભાગ અને હિસ્સ સાથેની મિલકતનો કલેટ નં ૩૦૨, ત્રીજો માળ, સુરત મ્યુનિસીપલ કોર્પોરેશન મ મંજુર થયેલ બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ પ૯.૬૯ સ્કે.મી., રેરા મુજબ કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ પ૧.૭૬ સ્કે.મી., બાલ્કની નું ક્ષેત્રફળ ૧.૨૬ સ્કે.મી. અને વોર એરીયા નું ક્ષેત્રફળ ૨.૯૬ સ્કે.મી., અવિભાજીત હક

ઉપરોક્ત સંજોગોમાં, ઉપરોક્ત ઉધારર્તાઓ, સહ - ઉધારકર્તાઓ અને / અથવા તેમના બાંયધરી આપનારાઓ (જયાં પણ લાગ્ હોય) નોટીસ આપવામાં આવે છે કે તેઓ તારીખ થી ૬૦ દિવસની અંદર ભાવિ વ્યાજ અને લાગુ પડતા શુલ્ક સાથે ઉપરોક્ત ઉલ્લેખિત બાકી લેણાં ચુકવે. આ નોટીસના પ્રકાશનમાં નિષ્ફળ જવા પર, જે આ નોટીસની તારીખના ૬૦ દિવસની સમાપ્તિ પછી સિકયોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૪) હેઠળ ઉધારકર્તાઓ અન ગીરોની મુકરર મિલકતો સામે પગલાં લેવામાં આવશે.

પ્લેટીનિયમ પોઈન્ટ, સુદામા ચોરની પાસે, મોટા વરાછા, સુરત,

ગુજરાત - ૩૯૪૧૦૧.

અને અહીં પણ : મુંજપરા પ્રદિપભાઈ હસમુખભાઈ,

મિલકતનું સરનામું :- ફલેટ નં. સી-૩૦૨, ત્રીજો માળ, સી - બિલ્ડીંગ,

ઓમકાર એવન્યુ, બ્લુ હોરીઝોન ની બાજુમાં, સહજાનંદ સ્કર્વેરની સામે.

જુનો કોસાડ રોડ, કોસાડ, સુરત, ગુજરાત - ૩૯૪૧૦૭.

એનપીએ તારીખ : ૦૪.૦७.૨૦૨૪

ડીમાન્ડ નોટીસની તારીખ : ૨૪.૦૯.૨૦૨૪

સ્થળ : સુરત, વડોદરા - નડીચાદ

તારીખ : ૦૬.૦૮.૨૦૨૪

મહેરબાની કરીને નોંધ કરો કે ઉપરોક્ત અધિનેયમની કલમ ૧૩(૧૩) હેઠળ, કોઈપણ લેણદાર, સિકયોર્ડ લેણદારની પૂર્વ લેખિત સંમતિ વિના નોટીસમાં ઉલ્લેખિત તેની સુરક્ષિત સંપત્તિ વેચાણ, લીઝ અથવા અન્યથા કોઈપણ રીતે ટ્રાન્સફર કરી શકશે નહી.

> અધિકૃત અધિકારી, શ્રીરામ હાઉસીંગ ફાઈનાન્સ લિમીટેડ

0001874

SHLHSRAT

0001874

રૂા.

23,00,969/-

અને હિસ્સા સાથેની જમીન

સાથે ની બિલ્ડીંગ નં. સી,

ઓમકાર એવન્યુ, જે સ્થિત

અને બાંધકામ કરેલ જમીનનો

રેવન્યુ સર્વે નં. ૨૮, બ્લોક નં.

૪૬, ટીપી સ્કીમ નં. ૬૬

(કોસાડ - વરીયાવ), એફપી

નં. ૪૪, ક્ષેત્રફળ ૪૬૦૩

સ્કે.મી., ગામ - કોસાડ, સબ

જીલ્લો - સુરત સીટી, જીલ્લો

સુરત. ચતુઃસીમા :- પૂર્વે

બિલ્ડીંગ - ડી, **પશ્ચિમે** : રોડ

ઉત્તરે : બ્લોક નં. ૩૮, દક્ષિણે

: સોસાયટી રોડ.